

ફોજદારી ઇન્કવાયરી નં. ૨૯/ ૨૦૨૬

અરજદાર રક્ષાબેન સચીનભાઈ ટાંકની બી એન એસ એસની કલમ- ૪૯૭
અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ

- (૧) અરજદારની હાલની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિ.એ.પી.પી.શ્રીને સાંભળ્યા.તપાસ કરનાર અમલદારશ્રીનો અભિપ્રાય તેમજ રજુ દસ્તાવેજો ધ્યાને લીધા.
- (૨) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ છે, જે અરજદારના ગુજરાત ગ્રામીણ બેન્કના ખાતામાંથી રૂ.૯૦,૦૦૦/- ડેબીટ થયેલા જેથી તેઓએ સાઈબર ક્રાઇમ ફોડ બાબતે એન.સી.સી.આર.પી પોર્ટલ પર અરજી નં ૩૧૧૦૫૨૬૦૧૧૪૪૯૯ થી સાઈબર ક્રાઇમ પો.સ્ટે દેવભૂમિ ધ્વારકા સમક્ષ રજૂ કરેલ જેની તપાસ થઈ તેમની સાથે થયેલ ફોડની રકમ પરત મેળવવા અરજદાર દ્વારા હાલની અરજી દાખલ કરવામાં આવેલી છે.
- (૩) બનાવમાં તેઓના ગુજરાત ગ્રામીણ બેન્ક ખાતા નં. 78034790034 અને IFSC Code BARB0BGGBXX માંથી રૂ. 90,000/- ઉપડી ગયેલ છે. જે બાબતે તેઓએ સાયબર ક્રાઇમ, દેવભૂમિ દ્વારકા સમક્ષ ફરીયાદ નોંધાવેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સામાવાળાના કોટક મહીન્દ્રા બેન્ક ખાતા નં. 2945270784 અને IFSC Code No. KKBK0007466 માં રૂ. 90,000/- બી એન એસ એસ કલમ-૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ. આર. થયેલ

નથી. તેઓને ખુબ જ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓનાં ખાતામાં પરત અપાવવા માટે બી એન એસ એસની કલમ- ૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

- (૪) અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે સાયબર ક્રાઇમ પો સ્ટે, દેવભુમી ધ્રારકા, નાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહીત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ. જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પો સ્ટે, દેવભુમી ધ્રારકા નાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓને જણાવેલ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે આવા નાણાંને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્થ પ્રોજેક્ટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સાયબર ક્રાઇમ પો સ્ટે, દેવભુમી ધ્રારકા હસ્તક ચાલું છે અને તેઓ પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પો સ્ટે, દેવભુમી ધ્રારકા ખાતે ફરજ બજાવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટમાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાણાં જ્યારે ઓનલાઈન ટ્રાન્સફર થઈ જતા હોય છે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે. સાયબર ક્રાઇમના ભોગ બનનાર નાગરીકો સીધી જ પોતાની ફરીયાદ ૧૦૦ નંબર(હાલ ૧૯૩૦) પર ડાયલ કરીને લખાવે છે ત્યારે ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ દ્વારા એક ટીકીટ નંબર આપવામાં આવે છે તેમજ સાથો સાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણાં ગયેલ હોય તે બેંકને નાણાં ફીઝ કરાવવા તેમજ જો નાણા ત્યાંથી ટ્રાન્સફર થઈ ગયેલ હોય તો તેની માહિતી આપવા

માટે તેઓની કચેરીએથી નોટીસ આપવામાં આવે છે. નોટીસ આધારે બેંકો દ્વારા આ શંકાસ્પદ રીતે મેળવાયેલા નાણાં ફીજ કરવામાં આવે છે.

- (૫) પોલીસ ઈન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ પો સ્ટે, દેવભુમી ઢાંચકા નાઓએ વધુમાં જણાવેલ છે કે, હાલના અરજદારશ્રીનાએ સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ હતો. જેમા અરજદારની ગુજરાત ગ્રામીણ બેન્ક ખાતા નં. 78034790034 અને IFSC Code BARB0BGGBXX માંથી રૂ. 90,000/- માંથી ઉપડી ગયેલ છે જે બાબતે અરજદારે પોતાની ફરીયાદ આશ્વત પ્રોજેક્ટમાં 1930 નંબર ઉપર ફરીયાદ નોંધાવેલ હતી. આ અરજદારની ફરીયાદ આધારે સાયબર ક્રાઇમ સેલ સીઆઈડી ક્રાઇમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણાં પૈકી સામાવાળાઓનાં ખાતામાં તેઓના ગયેલ નાણાં રૂ. 90,000/- બી એન એસ એસ કલમ- ૧ ૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણા પાછા ખેંચવા માટે અરજદારશ્રીએ આપ નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સારું તેઓનો અભિપ્રાય માંગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદારશ્રીનાઓના સામાવાળાનાં ખાતામાં તેઓના ગયેલ નાણાં રૂ. 90,000/- ફીઝ થયેલ છે જે સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલ છે તથા સદરહું ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે. આમ, સદર હકીકત ધ્યાને લેતાં અરજદારના ઉપર જણાવ્યા મુજબના ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકનાં ખાતામાં ટ્રાન્સફર થયાનું હાલનાં તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદ્દપરાંત રેકર્ડ પર ની હકીકત ધ્યાને લેતાં હાલનાં કામે આજદીન સુધી કોઈ એક્ઝાઈઆર થયેલ હોય કે હાલના કામે કોઈની ઘરપકડ કરવામાં આવેલ

હોય તેમ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યે આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદીન સુધી અરજદાર સિવાય અન્ય કોઈ એ સદર નાંણાની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદ્દપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતાં તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાંની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેન્ક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહું ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ(પોલીસ) સમક્ષ કોઈ વાં ઘા તકરાર લીધેલ નથી જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણાં અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતનાં માનવા મુજબ હાલનાં અરજદાર સદર નાણાં પરત મેળવવા હકકદાર હોવાનું જણાય છે.

- (૬) આ તબક્કે સદર નાણાં પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમતજોતાં બી એન એસ એસની કલમ ૫૦૩ (ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ- ૪૫૭) માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે.

503. Procedure by police upon seizure of property

(1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry or trial, the Magistrate may make such order such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of

such property.

(2) if the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property, consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

આમ બી એન એસ એસ ૫૦૩ (ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૪૫૭(૧) માં જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા જપ્તીની જાણ મેજીસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજીસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબ્જા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે.

- (૭) આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતાં સદર નાણાં બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબરબાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યમાં પણ મુદ્દામાલની ઓળખ બાબતની

કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧) જી. એલ. એચ. પાના નંબર. ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવા માં આવે છે.

-::: હુકમ :::

૧. અરજદારની અરજી આથી બી એન એસ એસ ૫૦૩ (ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ-૪૫૭) હેઠળ આથી મંજૂર કરવામાં આવે છે.
૨. અરજદારે સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ રૂ. ૯૦,૦૦૦/- ના દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સધ્ધર જામીન સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપેથી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
૩. વધુમાં હુકમ કરવામાં આવે છે કે અરજદાર દ્વારા હુકમ મુજબનાં જાત જામીન (બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ ગુજરાત ગ્રામીણ બેન્કને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદાર હુકમ મુજબનાં જાત જામીન (બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦ માં કોટક મહીન્દ્રા બેન્ક ખાતા નં. 2945270784 અને IFSC Code No. KKBK0007466 માં રૂ. ૯૦,૦૦૦/- જમા છે તે અરજદાર રક્ષાબેન સચીનભાઈ ટાંકના ગુજરાત ગ્રામીણ બેન્ક ખાતા નં. 78034790034 અને IFSC Code BARB0BGGBXX માંથી રૂ. ૯૦,૦૦૦/- માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો:-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણાં અત્રેની અદાલતમાં ભરવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણાં પર કલેઈમ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની રહેશે.
- (૩) કોઈપણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપો આપ રદ્દ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ તા: ૦૧/૦૭/૨૦૨૬ ના રોજ ખૂલ્લી અદાલતમાં વાંચી, સંભળાવી, મારી સહી કરી આપી, જાહેર કરવામાં આવ્યો.

તા. ૦૩/૦૭/૨૦૨૬.

(એ.એ.શેખ)

સ્થળ: ઢ્ઠારકા.

એડીશ્નલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ

ઢ્ઠારકા. જજ કોડ નં. GJ01163